

કપાસની જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન અંગે ખેડૂત દિનની ઉજવણી

પ્રેસનોટ

આણંદ કૃષિ યુનિવર્સિટીની બં. અ. કૃષિ મહાવિદ્યાલયનાં કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા ખેડૂતોને મુંઝવતા કપાસનાં પાકને લગતા પ્રશ્નોનાં નિરાકરણ અર્થે તેમના જ વિસ્તારમાં બધી જ માહિતી મળી રહે તેવા શુભ આશયથી “કપાસની જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન” અંગેનાં ખેડૂત દિનની ઉજવણી બરવાળા, જીલ્લો બોટાદ ખાતે તા. ૦૪-૦૧-૨૦૨૦ ને શનિવારનાં રોજ માનનીય કુલપતિશ્રી ડો. આર. વી. વ્યાસનાં અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી, જેમા અંદાજીત ૧૦૦૦ જેટલા કપાસ ઉગાડતા ખેડૂતોએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં ડો. એચ. બી. પટેલ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક, આકૃયુ, આણંદ, ડો. એમ. વી. પટેલ, આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ, શ્રી એમ. બી. પટેલ, સંયુક્ત ખેતી નિયામક, શ્રી ડી. કે. સિંનોરા, નાયબ ખેતી નિયામક અને શ્રી એસ. જી. ગઢીયા, જીલ્લા ખેતીવાડી અધિકારી, બોટાદ અતિથિ વિષેશ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરુઆત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય અને અનુસ્નાતક વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવો, વૈજ્ઞાનિકો અને અન્ય મહેમાનોનું શાબ્દિક સ્વાગત ડો. પી. કે. બોરડ, પ્રાધ્યાપક અને વડા, કીટકશાસ્ત્ર વિભાગે કર્યું અને કપાસના પાકને લગતી સમસ્યાઓથી સૌને વાકેફ કર્યાં. શાબ્દિક સ્વાગત બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા ખાસ કરીને કપાસ ઉગાડતા ખેડૂતોની હાલની સમસ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં ફોલ્ડર “બીટી કપાસની ગુલાબી ઇયળ અને તેનું સંકલિત વ્યવસ્થાપન” અંગેનું વિમોચન માન. કુલપતિશ્રી અને અન્ય મંચસ્થ મહાનુભવોના વરદ હસ્તે કરવામાં આવ્યું. અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા ડો. આર. વી. વ્યાસ, માનનીય કુલપતિશ્રીએ ખેડૂતોને સજીવ ખેતીનું મહત્વ સમજાવ્યું અને કૃષિ યુનિવર્સિટી દ્વારા થયેલ સંશોધનને અપનાવી ખેત ઉત્પાદન વધારવા આહવાન કરેલ. ડો. એચ. બી. પટેલ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામકએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજીત કરવામાં આવતી વિવિધ તાલિમો વિશે માહિતી આપી અને તેમાં ભાગ લેવા ખેડૂતોને જણાવેલ. ડો. પી. કે. બોરડે યોજનાની રૂપરેખા સાથે અત્યારની સૌથી જટીલ સમસ્યા કપાસની ગુલાબી ઇયળનાં વ્યવસ્થાપન માટે લેવામાં આવતા પગલાં વિશે સૌને અવગત કર્યાં. ડો. આર. કે. ઠુમર, સહ પ્રાધ્યાપક દ્વારા કપાસમાં આવતી ચૂસીયા પ્રકારની જીવાતોના નુકસાન અને તેમના નિયંત્રણ અંગેની સવિસ્તૃત માહિતી આપવામાં આવી. કપાસની નવીનતમ જીવાતો તથા મકાઈની પૂછડે ચાર ટપકાવાળી ઇયળ અને તેના નિયંત્રણ અંગેની સવિસ્તાર

માહિતી ડો. ડી. બી. સિસોદીયા, સહ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી. પ્રો. મીરલ ડી. સુથાર, મદદનીશ પ્રાધ્યાપકે કપાસના પાકમાં આવતા મિલીબગ (ચીકટો) અને તેના નિયંત્રણ માટે કયા કયા પગલાં લેવા તે અંગેની વિસ્તૃત છણાવટ કરી. બોટાદ વિસ્તારને ધ્યાનમાં રાખીને શિયાળુ પાકોમાં આવતી વિવિધ જીવાતો અંગેની વિસ્તૃત માહિતી ડો. સી. બી. ધોબી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી. ડો. વી. પી. રામાણી, સહ સંશોધન નિયામકે પાકને જરૂરી સૂક્ષ્મતત્વો વિશે મહત્વની માહિતીને વણી લઈ આવા કાર્યક્રમોનો મહત્તમ લાભ લેવા ખેડૂતોને હાંકલ કરેલ. કપાસના પાકમાં આવતા રોગ નિયંત્રણ અંગેની માહિતી ડો. આર. જી. પરમાર, પ્રાધ્યાપક અને વડા, રોગશાસ્ત્ર વિભાગે આપી. વિવિધ પાકોમાં નીંદણથી થતું નુકસાન અને તેનું નિરાકરણ અંગેની માહિતી ડો. બી. ડી. પટેલ, સંશોધન વૈજ્ઞાનિક (નીંદણ) દ્વારા પુરી પાડવામાં આવી. ડો. આર. આર. આચાર્ય, સંશોધન વૈજ્ઞાનિકે શાકભાજીની વિવિધ જાતો અને આ વિસ્તારમાં તેનો અવકાશ જ્યારે ડો. જે. એસ. પટેલ, સહ પ્રાધ્યાપક, બાગયત વિભાગ દ્વારા જામફળ અને લીંબુ પાકોના અવકાશ અને તેના પ્રશ્નો અંગે છણાવટ કરી. ડો. ટી. ટી. પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિકે દેશી કપાસ અંગેની માહિતી પુરી પાડેલ. ડો. જીગર એચ. પટેલ દ્વારા પશુઓની પસંદગી તથા તેનું દુધ ઉત્પાદન વધારવાનાં ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપી. શ્રી એમ. બી. પટેલ, સંયુક્ત ખેતી નિયામકે આવા કાર્યક્રમો દ્વારા ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાનું એક ખુબજ અગત્યનું માધ્યમ દર્શાવી હાલનાં ખેતી વિષયક પ્રશ્નોની જાણકારી આપેલ. કપાસ અને અન્ય પાકમાં ખાતર અને પિયતનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની ટૂંકી માહિતી ડો. એમ. વી. પટેલ, આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષે આપી અને આ અંતરિયાળ વિસ્તારમાં આવા વિશાળ ખેડૂત દિનનું આયોજન કરવા બદલ કીટકશાસ્ત્ર વિભાગના વડા ડો. પી. કે. બોરડ અને તેની ટીમને વિશેષ અભિનંદન પાઠવેલ. કાર્યક્રમને સફળ બનાવવામાં વિભાગના મીનાક્ષી લુણાગરીયા, સાવન સેવક, રેખાબેન ઠાકોર તથા વાડીના માલિકશ્રી ભરતભાઈ મોરી અને રણજીતભાઈ મોરીનો મહત્વનો ફાળો હતો.

આ કાર્યક્રમનું દુરદર્શન અને ઓલ ઈન્ડીયા રેડીયો દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડો. આર. કે. કુમર, સહ પ્રધ્યાપક તથા આભારદર્શન ડો. ડી. બી. સિસોદીયા, સહ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા કરી કાર્યક્રમને પુર્ણ જાહેર કરવામાં આવેલ.

બરવાળા મુકામે યોજાયેલ ખેડૂતદિનની ઝલક



